



જાહેરાત

બુલ મધર ફાર્મ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, અમરેલી

ગીર પશુઓ અને જાફરાબાદી ભેંસના વેચાણ માટેની જાહેરાત - **બીજો પ્રયત્ન**

બુલ મધર ફાર્મ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, અમરેલી ખાતે ગીર ઓલાદની ત્રણ ગાયો, બે વોડકીઓ અને ચાર ખસી વાછરડા તથા એક જાફરાબાદી ભેંસના વેચાણ માટે પશુપાલકો પાસેથી સીલબંધ કવરમાં ટેન્ડર મંગાવવામાં આવે છે.

- (૧) ટેન્ડર ફોર્મની કિંમત રૂ. ૨૦૦/- પ્રતિ ટેન્ડર ફોર્મ,
- (૨) ટેન્ડર સાથે ડીપોઝીટ રૂ. ૨૦૦૦/- રોકડા જમાં કરાવવાના રહેશે,
- (૩) ટેન્ડર વેચાણ તથા પશુઓ જોવાની તારીખ: ૨૩/૦૯/૨૦ થી તા. ૦૩/૧૦/૨૦,
- (૪) ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તા. ૦૩/૧૦/૨૦૨૦ સાંજે ૬:૦૦ કલાક સુધી,
- (૫) ટેન્ડર ખોલવાની તારીખ: ૦૬/૧૦/૨૦૨૦ સવારે ૧૧:૦૦ કલાકે.

ઓફીસ ફોન: ૯૪૨૬૪ ૭૧૨૧૦

તારીખ : ૨૩/૦૯/૨૦૨૦

સંશોધન વૈજ્ઞાનિક, બુલ મધર ફાર્મ,
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, ઠેબી ડેમ પાસે, પ્રતાપપરા, અમરેલી

બુલ મધર ફાર્મ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, અમરેલી

ટેન્ડર ફોર્મ : વર્ષ ૨૦૨૦-૨૧ (બીજો પ્રયત્ન)

ડીપોઝીટ પહોચ નં. _____ તા. _____

વેચાણ માટેની ગીર ગાયો અને જાફરાબાદી ભેંસની વિગત

ક્રમ	પશુ નામ, ઓળખ નંબર	જન્મ તારીખ	માતાનું નામ, નંબર	પિતાનું નામ	છેલ્લે વિચાર તા.	છેલ્લે વસૂક્યા તા.	કુલ વિચાર	૩૦૦ દિવસનું મહત્તમ દૂધ ઉત્પા.	છેલ્લે ફેળવ્યા તા.	હાલ સગર્ભા / ખાલી	નિકાલનાં કારણો	માંગણીદારની માંગણી (રૂ.)	
												અંકે	શબ્દોમાં
૧	ગાય અમી, ૬૯-૧૦	૨૯/૦૯ /૨૦૧૦	આશા, ૩૨-૦૩	સુખદેવ	૩૦/૧૨ /૨૦૧૯	૨૧/૦૫ /૨૦૨૦	૪	૧૩૮૫.૧ લી.	૧૩/૦૩ /૨૦૨૦	ખાલી	ઓછું દૂધ ઉત્પાદન, "બુલર કાઉ" ના લક્ષણો, વારંવાર ઉથલા મારવા તેમજ એક આંચળ બંધ		
૨	ગાય જસ્વીતા, ૦૩-૧૩	૧૫/૦૧ /૨૦૧૩	જગદંબા, ૯૨-૦૭	રાજ	૦૫/૧૧ /૨૦૧૯	૩૧/૦૫ /૨૦૨૦	૨	૭૫૮.૭ લી.	૦૬/૦૩ /૨૦૨૦	ખાલી	ઓછું દૂધ ઉત્પાદન, વારંવાર ઉથલા મારવા		
૩	ગાય ક્રેણ, ૬૧-૧૧	૨૯/૦૪ /૨૦૧૧	કેશર, ૧૩-૦૦	દેવાનંદ	૧૪/૦૮ /૨૦૧૯	૩૧/૦૫ /૨૦૨૦	૩	૨૧૪૮.૩ લી.	૦૯/૦૧ /૨૦૨૦	ખાલી	વારંવાર ઉથલા મારવા તથા વખતો વખત જનનાંગોનું પ્રોલેપ્સ		
૪	ભેંસ દામુ, ૦૨-૧૩	૦૮/૦૧ /૨૦૧૩	ઢીંગલ, ૧૪-૧૧	રાજ	૨૧/૦૯ /૨૦૧૬	૧૮/૦૪ /૨૦૧૮	૧	૨૩૨૫.૯ લી.	૧૩/૦૩ /૨૦૨૦	ખાલી	પ્રજનન અંગોની ખામીને લીધે સગર્ભા ન થવાને કારણે		

માંગણીદારનું નામ : માંગણીદારની સહી :

સરનામું :

ફોન નંબર :

(...૨...પાછળ)

(...ર...)

બુલ મધર ફાર્મ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, અમરેલી

ડીપોઝીટ પહોચ નં. _____ તા. _____

વેચાણ માટેની ગીર વોડકીઓની યાદી										
ક્રમ	નામ, ઓળખ નંબર	જન્મ તારીખ	માતાનું નામ, નંબર	પિતાનું નામ	માતાનું ૩૦૦ દિવસનું મહત્તમ દૂધ ઉત્પા.	છેલ્લે ફેબ્રુઆરી તા.	હાલ સગર્ભા / ખાલી	નિકાલનાં કારણો	માંગણીદારની માંગણી (રૂા)	
									અંકે	શબ્દોમાં
૧	વોડકી, ૬૦-૧૬	૧૨/૦૫ /૨૦૧૬	બુલબુલ, ૦૯-૦૮	હાતિમ	૨૮૨.૫ લી.	૨૨/૦૧/ ૨૦૨૦	ખાલી	પાછળના જમણા પગે ફેકચર તથા શારીરિક વિકાસ/વૃદ્ધિ સંતોષકારક નથી		
૨	વોડકી, ૦૬-૧૮	૦૩/૧૨ /૨૦૧૮	નુતન, ૦૨-૧૧	મોહન	૧૭૬.૨ લી.	---	ખાલી	માતા(નુતન, ૦૨-૧૧)ની જેમ ઉગ્ર સ્વભાવ તથા માતાનું નહીવત દૂધ ઉત્પાદન		

વેચાણ માટેની ગીર ખસી વાછરડાઓની યાદી								
ક્રમ	નામ, ઓળખ નંબર	જન્મ તારીખ	ઉંમર	માતાનું નામ, નંબર	પિતાનું નામ	શારીરિક ખોડખાપણ	માંગણીદારની માંગણી (રૂા)	
							અંકે	શબ્દોમાં
૧	૫-૧૮	૨૦-૧૦-૧૮	૨૩ માસ	હેપી, ૪૨-૧૧	સારંગ	નથી		
૨	૨-૧૯	૧૪-૦૮-૧૯	૧૩ માસ	કરેણ, ૬૧-૧૧	પરેશ	નથી		
૩	૪-૧૯	૨૨-૧૦-૧૯	૧૦ માસ	આલીયા, ૭૭-૧૩	પરેશ	નથી		
૪	૫-૧૯	૦૫-૧૧-૧૯	૧૦ માસ	જસ્વીતા, ૦૩-૧૩	સુરજ	નથી		

માંગણીદારનું નામ : માંગણીદારની સહી :

સરનામું :

ફોન નંબર :

- ૧) પશુઓ ખરીદવા માટે ખેડૂત/પશુપાલકોએ તા. ૨૩-૦૯-૨૦૨૦ થી તા. ૦૩-૧૦-૨૦૨૦ દરમિયાન, ટેન્ડર ફોર્મનાં રૂ. ૨૦૦/- રોકડા ભરી અત્રેની કચેરીમાંથી ૮-૦૦ થી ૧૨-૦૦ તથા ૩-૦૦ થી ૬-૦૦ દરમિયાન મેળવવાનાં રહેશે. ટેન્ડર ફોર્મનાં રૂપિયા પરત મળવાપાત્ર નથી.
- ૨) દરેક પશુપાલકોએ ટેન્ડર ફોર્મ સાથે ખેડૂત/પશુપાલક હોવા અંગેનો ગ્રામ પંચાયતનો દાખલો જોડવાનો રહેશે અથવા ૭/૧૨ નો દાખલો જોડવાનો રહેશે. અન્યથા ટેન્ડર અમાન્ય ગણાશે.
- ૩) દરેક પશુપાલકોએ ટેન્ડર સાથે રૂ. ૨૦૦૦/- (રૂપિયા બે હજાર પુરા) ડીપોઝીટ તરીકે અત્રેની કચેરીએ ભરવાનાં રહેશે. ટેન્ડરમાં ડીપોઝીટ ભર્યાનો પહોંચ નંબર અચૂક લખવાનો રહેશે તથા પહોંચની ઝેરોક્ષા નકલ જોડવાની રહેશે. વેચાણની કામગીરી પૂર્ણ થયે, ડીપોઝીટના નાણાં, અસલ પહોંચ સામે પરત કરવામાં આવશે.
- ૪) ટેન્ડર ફોર્મમાં દરેક પશુઓની જરૂરી વિગત દર્શાવેલ છે, પશુપાલકે જે પશુ / પશુઓ ખરીદ કરવા ઇચ્છે, તેને સંપૂર્ણ રીતે જોઈ-ચકાસી, પોતાની સમજ, સૂઝ હોશિયારી તથા જવાબદારીથી તેની સામે કિંમત લખવાની રહેશે.
- ૫) ટેન્ડર ભરનાર પશુ પાલકે ટેન્ડર ફોર્મમાં જણાવેલ પશુ સામે ચેક-ચાક વગર અંક તેમજ શબ્દોમાં કિંમત લખવી, કિંમતમાં ચેક-ચાક થયેલ હોય તો તેની સામે પોતાની ટુંકી સહી કરવી.
- ૬) પશુપાલકો વેચાણમાં રાખેલ પશુઓને તા. ૨૩-૦૯-૨૦૨૦ થી તા. ૦૩-૧૦-૨૦૨૦ દરમિયાન ઓફીસ સમયે અત્રેના ફાર્મમાં જોઈ શકશે.
- ૭) ભરેલા ટેન્ડર ફોર્મ બંધ કવરમાં તા. ૦૩-૧૦-૨૦૨૦ સાંજે ૬.૦૦ સુધીમાં અત્રેની કચેરીમાં મળી જાય તે રીતે રૂબરૂ હાથો-હાથ પહોંચતા કરવાનાં રહેશે / કચેરીમાં રૂબરૂ જમાં કરવાના રહેશે.
- ૮) ભરેલા ટેન્ડર તા. ૦૬-૧૦-૨૦૨૦ ના રોજ સવારે ૧૧-૦૦ (અગીયાર) કલાકે નિયત કમીટી ધ્વારા અત્રેની કચેરીમાં ખોલવામાં આવશે.
- ૯) માંગણીદાર પશુપાલકની ડીપોઝીટ પેટે ભરેલ રકમની અસલ પહોંચ કચેરીમાં રજૂ કરી, ડીપોઝીટ પરત મેળવી લેવાની જવાબદારી માંગણીદારની પોતાની રહેશે અને માંગણીદાર તા. ૧૫-૧૦-૨૦૨૦ સુધીમાં ડીપોઝીટ પરત નહિ લઈ જાય તો તેમની ડીપોઝીટ જપ્ત થશે.
- ૧૦) જે પશુપાલકની ટેન્ડરમાં જે-તે પશુની ભરેલ કિંમત સૌથી વધુ હશે તેમને જે-તે પશુ વેચાણ કરવામાં આવશે. સદર પશુપાલકોએ પશુ / પશુઓની પૂર્ણ રકમ દિવસ ત્રણમાં (તા. ૦૭-૧૦-૨૦૨૦ થી તા. ૦૯-૧૦-૨૦૨૦ સુધીમાં) ભરી અત્રેના ફાર્મમાંથી લઈ જવાનાં રહેશે. ઉપરોક્ત સમય દરમિયાન પશુપાલક પશુ ન લઈ જાયતો, તા. ૦૯-૧૦-૨૦૨૦ પછી વધારાનાં દરેક દિવસ માટે પશુ દીઠ દૈનિક રૂ. ૨૦૦/- ખાધા-ખોરાકી પેટે વસૂલ કરવામાં આવશે.

(...૨...)

- ૧૧) તા. ૧૫-૧૦-૨૦૨૦ પછી પણ પશુપાલક પશુઓ ન લઈ જાય તો તેમની ડીપોઝીટ જપ્ત થશે અને ત્યાર પછી તેમને પશુ વેચાણ આપવામાં આવશે નહીં.
- ૧૨) કોઈપણ સંજોગોમાં તા. ૦૭-૧૦-૨૦૨૦ પહેલાં પશુઓ આપવામાં આવશે નહીં.
- ૧૩) માંગણીદાર/પશુપાલકનું ટેન્ડર પાસ થયું કે નાપાસ તે અત્રેની કચેરીએથી જાણવાની જવાબદારી પશુપાલકની પોતાની રહેશે. આ સંદર્ભમાં અત્રેની ઓફિસ ધ્વારા કોઈપણ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં તથા તે અંગે કોઈ જવાબદારી અત્રેની કચેરીની રહેશે નહીં.
- ૧૪) ટેન્ડર પાસ થયા પછી તા. ૧૫-૧૦-૨૦૨૦ સુધીમાં પશુઓ ન લઈ જાય અને તે દરમિયાન પશુને કોઈ ઈજા થાય અથવા તો મૃત્યુ થાય તો આ કેન્દ્રની જવાબદારી રહેશે નહીં અને ભરેલ રકમ પરત આપવામાં આવશે નહીં.
- ૧૫) પશુ લઈ જતી વખતે પશુપાલકે પોતાના દોરડા, દોરી, જરૂરી માણસો સાથે લાવવાના રહેશે. અત્રેની કચેરીએથી કોઈ પણ પ્રકારના સાધનો અથવા માણસો આપવામાં આવશે નહિ. પશુ લઈ જવાનો સમય ૦૮-૦૦ થી ૧૨-૦૦ તથા ૦૩-૦૦ થી ૦૬-૦૦ રહેશે.
- ૧૬) કોઈપણ વાદ-વિવાદમાં વેચાણ-કમીટીનો નિર્ણય આખરી રહેશે તેમજ સૌને બંધનકર્તા રહેશે.
- ૧૭) દરેક પશુપાલકે ટેન્ડર ફોર્મ સાથે જોડેલ શરતો વાંચી સમજી-વિચારીને કિંમત ભરવાની રહેશે.
- ૧૮) અત્રેથી વેચાણ પામેલ જાનવરો પૈકી એકપણ જાનવર કસાઈવાડે ન જાય તેની સંપૂર્ણ જવાબદારી પશુ ખરીદનાર પશુપાલકની રહેશે. આ અંગેની કોઈ પણ જવાબદારી આ કચેરીની રહેશે નહીં.
- ૧૯) ટેન્ડર વેચાણથી ભાવપત્રકો ખોલવા સુધીની પ્રક્રિયા દરમિયાન કોઈ પશુ મરણ પામે તો તે પશુની માંગણી આપોઆપ રદ ગણવામાં આવશે .
- ૨૦) દરેક પશુપાલકે સંપૂર્ણ રીતે જોઈ, ચકાસી ટેન્ડર ભરવાના રહેશે જેથી ટેન્ડર પાસ થયા પછી કોઈ પણ પશુમાં ખામી/તકલીફ પશુપાલકના ધ્યાન પર આવે તો તે અંગેની જવાબદારી આ કચેરીની રહેશે નહીં.
- ૨૧) વેચાણ થયેલ પશુ કોઈપણ સંજોગોમાં સાંજે ૦૬:૦૦ વાગ્યા પછી અત્રેથી લઈ જવા દેવામાં આવશે નહીં અને તેનો ગેઈટ પાસ કાઢી આપવામાં આવશે નહીં.

સ્થળ : અમરેલી

તારીખ : ૨૩-૦૯-૨૦૨૦



સંશોધન વૈજ્ઞાનિક

બુલ મધર ફાર્મ,

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી,

અમરેલી

માંગણીદારની સહી :